

17th BIMSTEC Ministerial Meeting (April 01, 2021)

April 01, 2021

17મી બિમસ્ટેક મંત્રીમંડળીય બેઠક (એપ્રિલ 01, 2021)

એપ્રિલ 01, 2021

1. ભારતના વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે 1 એપ્રિલ 2021ના રોજ 17મી બિમસ્ટેક મંત્રીમંડળીય બેઠકમાં ભાગ લીધો હતો. શ્રીલંકાના અધ્યક્ષપદ હેઠળ યોજાયેલી બેઠક વર્ચ્યુઅલ મોડમાં યોજાઈ હતી જેમાં બિમસ્ટેકના તમામ સભ્ય દેશોએ ભાગ લીધો હતો.
2. આ બેઠક ખાતે ડો. જયશંકરે પોતાના નિવેદનમાં બિમસ્ટેકના માળખા હેઠળ પ્રાદેશિક સહકાર વધારવા તથા સંગઠનને વધુ મજબૂત, જીવંત, વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે ભારત જેમાં અગ્રણી દેશ છે તેવા ક્ષેત્રમાં થયેલી પ્રગતિ પર ભાર મૂક્યો હતો જેમાં ત્રાસવાદ વિરોધી કાર્યવાહી, આંતરરાષ્ટ્રીય અપરાધ, પરિવહન અને સંદેશાવ્યવહાર, પર્યટન અને પર્યાવરણ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને બીજી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે જેને ભારતે બિમસ્ટેક સહકારને ગાઢ બનાવવા માટે હાથ ધરી છે.
3. આ બેઠકમાં આગામી બિમસ્ટેક મંત્રણા ખાતે અપનાવવાના બિમસ્ટેક માસ્ટર પ્લાન ફોર ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટીને તથા આગામી બિમસ્ટેક મંત્રણા ખાતે સહી કરવા માટેના ત્રણ એમઓયુ /કરારને ટેકો અપાયો હતો જેમાં બિમસ્ટેક કન્વેન્શન ઓન મ્યુચ્યુઅલ લિગલ આસિસ્ટન્સ ઈન ક્રિમિનલ મેટર્સ, બિમસ્ટેકના સભ્ય દેશોના ડિપ્લોમેટિક એકેડેમી/તાલીમ સંસ્થાઓ વચ્ચે પરસ્પર સહકાર માટે એમઓયુ, અને કોલંબો, શ્રીલંકા ખાતે બિમસ્ટેક ટેકનોલોજી ટ્રાન્સફર ઇન્સિટિવિટી (ટીટીએફ)ની સ્થાપના માટે મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનનો સમાવેશ થાય છે.
4. તેમણે સભ્ય દેશોને બિમસ્ટેક ચાર્ટર અપનાવવા માટે તેમની આંતરિક પ્રક્રિયા પૂર્ણ કરવા પ્રોત્સાહન આપ્યું હતું અને બિમસ્ટેક ફેમવર્ક હેઠળ સહકારના ક્ષેત્રો અને પેટા ક્ષેત્રોના પુનઃગઠનને ટેકો આપ્યો હતો જે બિમસ્ટેકની આગામી મંત્રણા દરમિયાન અપનાવવામાં આવશે.
5. આ બેઠકમાં સભ્ય દેશો સાથે વિચારવિમર્શ કરીને આગામી કેટલાક મહિનાઓમાં પાંચમી બિમસ્ટેક મંત્રણા શ્રીલંકા ખાતે યોજવાની અધ્યક્ષની દરખાસ્તને આવકારવામાં આવી હતી.
6. આ બેઠકમાં એ વાતની નોંધ લેવાઈ હતી કે ભારતમાં શરૂ કરાયેલું બિમસ્ટેક સેન્ટર ફોર વેધર એન્ડ ક્લાઈમેટ સંપૂર્ણપણે કાર્યશીલ છે જે કુદરતી આફતો અંગે વહેલાસર ચેતવણી આપવા અન્યાધુનિક સાધનોથી સજ્જ છે.
7. મંત્રીઓએ ગઈ બિમસ્ટેક મંત્રણા વખતે ભારતના માનનીય વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલી કેટલીક પહેલના અમલીકરણને બિરદાવી હતી, જેમાં જાન્યુઆરી 2021માં વર્ચ્યુઅલ મોડમાં બિમસ્ટેક સ્ટાર્ટઅપ કોન્ક્લેવ, ફેબ્રુઆરી 2020માં પુરી ખાતે દ્વિતીય બિમસ્ટેક ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્સરસાઈઝ, ફેબ્રુઆરી 2020માં બિમસ્ટેક દેશોમાં ડૂગ ટ્રાફિકિંગ રોકવા માટે કોન્ફરન્સ, ડિસેમ્બર 2019માં નવી દિલ્હી ખાતે ક્લાઈમેટ સ્માર્ટ ફાર્મિંગ સિસ્ટમ્સ અંગે બિમસ્ટેક સેમિનાર, ડિસેમ્બર 2019માં ગાંધીનગર ખાતે ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાતે રિસ્ક ઈન્ફોર્મ્ડ અર્બન પ્લાનિંગ અંગે કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપ, સપ્ટેમ્બર 2018માં પૂણે ખાતે બિમસ્ટેક મિલિટરી એક્સરસાઈઝ અને આર્મી ચીફ્સ કોન્ક્લેવ, ઓક્ટોબર 2018માં નવી દિલ્હી ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2018 ખાતે બિમસ્ટેક મંત્રીમંડળીય કોન્ક્લેવ, ફેબ્રુઆરી 2020માં નવી દિલ્હી ખાતે સુખા સ્વરાજ ઈન્સ્ટિટ્યૂટ ફોર ફોરેન સર્વિસ ખાતે બિમસ્ટેક દેશોના રાજદ્વારીઓ માટે તાલીમ, જાન્યુઆરી 2020માં શિલોંગ ખાતે નોર્થ ઈસ્ટ સ્પેસ એપ્લિકેશન સેન્ટર

आते स्पेस अने रिमोट सेन्सिंग माटे बिमस्टेक टेशोना 24 संशोधनकर्ताओ/प्रोफ़ेशनल्सने तावीम, नावंद्रा युनिवर्सिटी
आते बिमस्टेक टेशोना विद्यार्थीओने 30 स्कॉलरशिप्स आपवानो समावेश थाय छे.

नवी दिल्ली
अप्रैल 01, 2021

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.